



RAN-2308000106051001

T.Y.B.Com. (Sem.-VI) Examination October - 2025

Advance Accounting and Auditing paper-VII

સૂચના : / Instructions

- (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી.
Fill up strictly the above details on your answer book

Seat No.:

--	--	--	--	--	--

Student's Signature

પ્ર.1. A. નીચેના બહુવિકલ્પીય પ્રશ્નોનાં જવાબ આપો.

5

- મુદત પુરી થતાં પહેલા પ્રથમ ઓડીટરને હટાવવા અંગે નીચેમાંથી કયું વિધાન સાચું નથી?
 - સામાન્ય સભા બોલાવવામાં આવે છે.
 - શેર હોલ્ડરો આમ કરવા માટે અધિકૃત છે.
 - ઓડીટરને દૂર કરવા માટે કેન્દ્ર સરકારની મંજૂરી જરૂરી છે.
 - ઓડીટરને હટાવવાની જોગવાઈઓ કલમ 224(7) માં સમાવિષ્ટ છે.
- ઓડીટરની દીવાની જવાબદારીમાં સમાવેશ થાય છે.
 - બેદરકારીની જવાબદારી
 - કર્તવ્ય ભંગની જવાબદારી
 - બેદરકારી અને કર્તવ્ય ભંગ ની જવાબદારી
 - ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં
- ક્યા સંજોગોમાં ચોખ્ખો અહેવાલ આપવામાં આવે છે?
 - નફા નુકસાન ખાતુ નફા કે નુકસાન અંગે સાચો અને વાજબી ખ્યાલ દર્શાવતું ન હોય
 - પાકું સરવૈયું ધંધાની સાચી અને વ્યાજબી પરિસ્થિતિ દર્શાવતું હોય.
 - ચોપડાઓની તપાસ દરમિયાન ભૂલો મળે.
 - કંપની ધારાની જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન થયું ન હોય
- શેર પ્રીમીયમ અને મુડી પરત અનામત નો ઉપયોગ શા માટે થઈ શકે છે?
 - છેવટનું ડિવિડન્ડ આપવા
 - વચગાળાનું ડિવિડન્ડ આપવા
 - પૂર્ણ ભરપાઈ શેર પર બોનસ આપવા
 - ઉપરોક્ત તમામ
- ડિરેક્ટરોએ કોઈપણ પ્રકારની રજુઆત ક્યારે કરવી પડતી નથી?
 - ચોખ્ખો અહેવાલ
 - ખામી વાળો અહેવાલ
 - A અને B બંને
 - ઉપરોક્ત કોઈપણ નહીં

B. ખાલી જગ્યા પૂરો**5**

1. કંપની એક્ટ 2013 ની _____ કલમમાં ઓડિટરની મહેનતાણાની જોગવાઈઓ આપવામાં આવી છે.
2. ઓડિટરને _____ સભામાં હાજર રહેવાનો અધિકાર છે.
3. વહેંચણી પાત્ર નક્કામાં _____ હોવો જોઈએ નહીં.
4. ઓડિટરનો અહેવાલ એ _____ વિશે નિષ્ણાતનો અભિપ્રાય છે.
5. _____ એ ઓડિટરે ચકાસેલ વિગતો અને હકીકતોની ખાતરી કર્યા પછી આપેલ નિવેદન છે.

C. નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો.**5**

1. હિસાબો રાખવા અને તૈયાર કરવા એ ઓડિટર માટે નિષેધાત્મક સેવા છે.
2. સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક શેર હોલ્ડર દ્વારા કરવામાં આવે છે.
3. ઓડિટરને દરેક સમયે કંપનીના ચોપડા, હિસાબો, દસ્તાવેજો અને વાઉચરો તપાસવાનો હક છે.
4. નક્કી કરેલ ટકાવારી મુજબ શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવતા નફાને મૂડી નફો કહેવાય છે.
5. જ્યારે ઓડિટર કોઈ ખામી દર્શાવીને અહેવાલ આપે છે તેને ચોખ્ખો અહેવાલ કહેવાય છે.

પ્ર.2. નીચેના પ્રશ્નોનાં ટૂંકમાં જવાબ આપો. (ગમે તે ચાર)**8**

1. ઓડિટરને દૂર કરવા અંગેની પ્રક્રિયા જણાવો.
2. ઓડિટ અહેવાલ ના પ્રકારો જણાવો
3. ચાલુ ઓડિટરની પુનઃ નિમણૂક ક્યા સંજોગોમાં કરવામાં આવતી નથી
4. સારા ઓડિટ અહેવાલના લક્ષણો જણાવો
5. નફો અને વહેંચણી પાત્ર નક્કાનો અર્થ સમજાવો
6. અન્વેષણના હેતુઓ જણાવો.
7. કરવેરા ઓડિટ કોણે કરાવવું પડે ?
8. ઈડીપી ઓડિટ નો અર્થ જણાવો.

પ્ર.3. અ. ઓડિટરની લાયકાતો અને ગેરલાયકાતો જણાવો.**7****બ. કંપની ઓડિટરની ફોજદારી જવાબદારીની ચર્ચા કરો.****6****અથવા****પ્ર.3. અ. ઓડિટ કાર્યક્રમ એટલે શું? ઓડિટ કાર્યક્રમ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની ચર્ચા કરો.****7****બ. અન્વેષણ એટલે શું? અન્વેષણ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા વિગતવાર સમજાવો.****6****પ્ર.4. અ. ટૂંકનોંધ લખો (ગમે તે બે)****8**

1. ઓડિટરના હક્કો
2. ડિવિડન્ડ અંગે ઓડિટર ની ફરજો
3. પડતર ઓડિટ ના ક્ષાયદા
4. માહિતી ટેકનોલોજી ઓડિટ

બ. તફાવત લખો (ગમે તે એક)**6**

1. ચોખ્ખો અહેવાલ અને ખામી વાળો અહેવાલ
2. પડતર ઓડિટ અને નાણાકીય વચ્ચેનો તફાવત

ENGLISH VERSION

Q.1. A. Give the correct Answer of the following MCQs.

5

1. Which of the following statements is not correct regarding removal of the first auditor before expiry of the Term.
 - A. His removal was confirmed at the General Meeting.
 - B. The shareholders are authorized to do so.
 - C. The Approval of the central government is required for such removal.
 - D. The provisions for search removal are contained in section 224 (7)
2. Civil liability of an auditor includes.
 - A. liability of negligence
 - B. liability of misfeasance
 - C. liability of negligence and liability of misfeasance
 - D. None of the Above
3. In which circumstances a clean audit report can be given?
 - A. Profit and loss account does not give a true and fair view of profit or loss.
 - B. When the balance sheet gives a true and fair view of the state of affairs.
 - C. Deficiency is found in examination of accounts.
 - D. The provisions of the company act are not properly Followed.
4. Share Premium and capital redemption reserve can be used for declaration of.
 - A. Final dividend
 - B. interim dividend
 - C. bonus shares
 - D. all of these
5. Director have not to give explanation on-
 - A. Clean Report
 - B. Qualified Report
 - C. Both A and B
 - D. None of the above

B. Fill in the Blanks.

5

1. Under The Company act 2013, section _____ contains provisions regarding remuneration of the auditor
2. The auditor has the right to attend _____ meeting of the company
3. Divisible profit should not include _____ .
4. The Auditor report is the expert's opinion on _____ .
5. _____ is a statement given by the auditor after the verify truth of such a statement.

C. Write True or False.

5

1. Accounting and book keeping services not to be rendered by auditor.
2. The auditor of a government company is appointed by the Shareholders.
3. Auditor of a company shall have a right of access, at all times, to the books, accounts and vouchers of a company.
4. The profit that is to be distributed among shareholders as per prescribed rate of dividend is called capital profit.
5. Auditor gives a report showing any defect is called a clean report.

- Q.2. Answer in brief (Any Four) 8**
1. State the procedure for removing an auditor.
 2. Show the types of Auditor's Report
 3. Under which circumstances the current auditor is not re-appointed?
 4. State the characteristics of a good audit report.
 5. Explain the meaning of Profit and divisible profit.
 6. State the Objectives of Investigation.
 7. Who is required to get Tax Audit?
 8. State the meaning of EDP Audit.
- Q.3. A. State qualifications and disqualifies of an Auditor. 7**
- B. Discuss Criminal Liabilities of an Auditor. 6**
- OR**
- A. What is Audit Programme? Explain points to be considered while preparing Audit Programme. 7**
- B. What is Investigation? Explain in details points to be considered while conducting an Investigation. 6**
- Q.4. A. Write Short Note: (Any Two) 8**
1. Auditor's rights.
 2. Duties of an Auditor Regarding to Dividend.
 3. Advantages of cost Audit.
 4. Information Technology Audit.
- B. Write the difference between (Any one) 6**
1. Clean Report and Qualified Report.
 2. Cost audit and financial audit.
-